



Galaxy Bearings Limited

[CIN: L29120GJ1990PLC014385]

Regd. Office: T-18, Vikram Chambers, Ashram Road, Ahmedabad - 380 009.
Tel.: (079) 27546020, **Fax No.:** (079) 27546535 **Email:** investor.gbl@gmail.com **Website:** www.galaxybearings.com

17th February, 2020

To,
The Bombay Stock Exchange Ltd
Phiroze Jeejeebhoy Towers,
Dalal Street,
Mumbai - 400 001.

Ref: // BSE: - Scrip Code: 526073 // Scrip ID: - GALXBRG //

Dear Sir,

Sub: Compliance of Regulation 47 of SEBI (Listing Obligations And Disclosure Requirements) Regulations, 2015.

Pursuant to Regulation 47 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, please find enclosed Public Notice published in the Newspapers viz. - Western Times (in English) and Western Times (in Gujarati-in vernacular language), informing about the Board Meeting scheduled to be held on Tuesday, 11th February, 2020 to, inter alia, consider and approve the unaudited Financial Results for the quarter ended 31st December 2019.

Kindly take the same on your records.

Yours faithfully,

For, **GALAXY BEARINGS LIMITED**



Dixit Patel
Chief Financial Officer

LOST CERTIFICATE
 Notice is hereby given that the Share Certificate of GRAPHITE INDIA LTD. Folio No. P0025714 Certificate No. 5948 for 350 Share Distinctive No. 4190186 to 4190535 Which were lost during house cleaning. It is requested that if there is any person collect in any way please inform us.
Mo : 8780421886
Kailashben R. Mokhasania

WESTERN TIMES
Disclaimer
 Advertisement appeared in this News Paper have not been verified factually and "WESTERTIMES" does not stand responsible for the sales proposition.

GUJARAT WATER SUPPLY & SEWERAGE BOARD
TENDER NOTICE NO. 17 OF 2019-20
 Executive Engineer, Public Health Division, Prason park society, Near Church, Dhulia Road, GWSSB Vyara (Ph. 02626-220338) invites on-line tenders through E-tendering single bid system from registered contractors in appropriate class with GWSSB, R & B Department / Irrigation Department for the works of 24 months of Comprehensive O & M following RWSS.

Sr. No.	Name of RWSS	Estimated Cost	Category	Tender ID No.
1.	South Nizar RWSS Ta. Nizar, Dist. Tapi	Rs.56,31,692.00	D Class & Above	397387

For further details of tender notice, scope of work tender fee, EMD and specification etc. Please visit Web sites <http://gwsb.nprocure.com> and above mentioned office. The last date of on-line bid submission is at. 25.02.2020 up to 18.00 hrs. Dept. reserves the right to reject any one or all tenders without assigning any reason. Now onwards, all the improvements / correction in the tender shall be done on-line only.
 For any query regarding rural water supply problem, please call on GWSSB Help Line No. 1916
No.Mahiti/Surat/1511/2020

GALAXY BEARINGS LIMITED
CIN: L29120GJ1990PLC014385
 Regd. Office : A-53/54 Pariseema Complex, C. G. Road, Ellisbridge, Ahmedabad - 380006.
 Tel.: +91- 9925018030. Email: investor.gbl@gmail.com • Website: www.galaxybearings.com

EXTRACT OF STATEMENT OF AUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED ON 31ST DECEMBER, 2019

(Rs. in Lacs, except per share data)

Sr. No.	Particulars	STANDALONE					
		Quarter Ended on		Nine Months Ended		Year Ended	
		31.12.2019	30.09.2019	31.12.2018	31.12.2018	31.12.2018	31.03.2019
1	Total income from operation	1359.33	1283.93	1591.21	3877.33	5200.67	7472.97
2	Net Profit / (Loss) from ordinary activities after tax	177.11	118.15	192.93	323.27	474.49	659.15
3	Total Comprehensive Income/(Loss) for the period	176.37	117.41	193.26	321.05	475.46	656.18
4	Equity Share Capital	318.00	318.00	318.00	318.00	318.00	318.00
Earning Per Share (of Rs. 10/- each)							
(A) Basic :		5.55	3.69	6.08	10.10	14.92	20.63
(B) Diluted :		5.55	3.69	6.08	10.10	14.92	20.63

1 The above figure have been reviewed by Audit Committee and approved by the Board
 2 Figures of the previous period have been regrouped / reclassified

*The company does not have any Extraordinary item to report for the above periods
 Notes: The above is an extract of the detailed format of Quarterly Financial Results filed with the Stock Exchange(s) under Regulation 33 of the SEBI (Listing Obligation and Disclosure Requirements) Regulations, 2015. The full formats of the Quarterly Financial Results are available at the Stock Exchange website (www.bseindia.com) and on company's website (www.galaxybearings.com).
 By Order of the Board
For, GALAXY BEARINGS LIMITED
 Bharatkumar K. Ghodasara
 (WholeTime Director) DIN: 00032054
 Place : Ahmedabad
 Date : 11th February 2020

CORAL LABORATORIES LIMITED
 Regd. Office: SF-206, Silver Oak Complex, B.P.C. Road, Vadodra-390020.
 Tel.: 022-25005245/46 Fax: 022-25004893 Website: www.coralab.com E-mail: cs@corallab.com
 Corp. Office: #3B, Patanwala Ind. Estate, Opp. Shreyas Cinema, L. B. S. Marg, Ghatkopar (West), Mumbai - 400 086
 CIN : L24231GJ1997PLC031669

Statement of Standalone Unaudited Financial Results for the Quarter and Nine Months ended 31st December, 2019 (Rs in lacs)(Except Figures in EPS)

Sr. No.	Particulars	Quarter ended	Nine Months ended	Quarter ended
		(31.12.2019)	(31.12.2019)	(31.12.2018)
1	Total Income from Operations (net)	2100.55	5283.22	2504.86
2	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items)	260.10	434.30	413.04
3	Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items)	260.10	434.30	413.04
4	Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items)	225.10	364.30	312.54
5	Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	199.56	-25.32	284.95
6	Paid up Equity Share Capital	357.26	357.26	357.26
7	Reserves (excluding Revaluation Reserve) as shown in the Balance Sheet of the previous year	0	0	0
8	Earnings Per Share (of Rs.10/- each) (for continuing and discontinued operations) -			
1. Basic:		6.30	10.20	8.75
2. Diluted:		6.30	10.20	8.75

Notes:
 1 The above is an extract of the detailed format of Quarter and Nine Months ended, 31st December, 2019. Unaudited Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarter and Nine Months ended 31st December, 2019 Unaudited Financial Results are available on the websites of the Bombay Stock Exchange and the Company.
 2 The above Unaudited Financial Results have been reviewed by the Audit Committee and approved by the Board of Directors at their meeting held on 12th February, 2020.
 For and on behalf of the Board of Directors of
Coral Laboratories Limited
 SD/-
 Girish Dhameja
 Whole-time Director
 (DIN : 07798455)
 Place : Mumbai
 Date : 12th February, 2020

AREX INDUSTRIES LIMITED
(CIN: L99999GJ1989PLC012213)
 Regd Office: 612, GIDC Estate, Chhatral, Tal.: Kalol, Dist.: Gandhinagar-382 729.
 Phone: +91 2764 233437 Email: mail@arex.co.in Website: www.arex.co.in

Statement of Standalone Unaudited Financial Results for the Quarter and Nine Months ended on 31st December, 2019

(Rs. In Lakhs)

Sr. No.	Particulars	Quarter Ended	Year to Date	Corresponding
		31/12/2019	31/12/2019	3 months ended in previous year
		Unaudited	Unaudited	Unaudited
1	(a) Revenue from operations	1265.67	3667.17	1056.71
2	Profit / (Loss) for the period (before tax, exceptional and extraordinary items and tax)	19.05	126.38	35.02
3	Profit / (Loss) for the period (before tax, after exceptional and extraordinary items and tax)	19.05	126.38	35.02
4	Profit / (Loss) for the period (after tax, after exceptional and extraordinary items and tax)	(13.26)	15.21	11.38
5	Total Comprehensive Income for the period (Comprising Profit / (Loss) for the period (after tax) and other comprehensive income (after tax))	(13.26)	15.21	12.25
6	Paid-up - Equity Share Capital [Face Value Rs. 10/- each]	395.87	395.87	395.87
7	Earnings per equity share (of 10/- each) (not annualised)			
(a) Basic		(0.34)	0.38	0.29
(b) Diluted		(0.34)	0.38	0.29

Notes:
 1 The Financial Results have been prepared in accordance with Indian Accounting Standards ("Ind-AS") prescribed under Section 133 of the Companies Act, 2013 read with the relevant rules thereunder and in terms of Regulation 33 of the SEBI (Listing Obligations & Disclosure Requirements) Regulations, 2015.
 2 The above results have been reviewed by the Audit Committee and taken on record by the Board of Directors at their meetings held on 12-02-2020.
 3 The Statutory Auditors have carried out a "Limited Review" of the Financial Result for the quarter and nine months ended on 31-12-2019.
 4 The Company does not have more than one reportable segment. Accordingly segmental information is not required to be provided.
 5 The figures for the corresponding periods have been regrouped / reclassified, wherever necessary, to make them comparable.
For AREX INDUSTRIES LIMITED
 Dinesh A Bilgi
 Managing Director
 (DIN: 00096099)
 Place : CHHATRAL
 Date : 12-02-2020

Xiaomi to attend MWC as planned, details precautions

Beijing, Chinese smartphone manufacturer Xiaomi has reaffirmed that it will participate at the Mobile World Congress (MWC) 2020 and will also stick to its original schedule. "With the continuing spread of the novel coronavirus (2019-nCoV) pneumonia, we would like to inform our fans, media friends, partners and users that the health and safety of everyone is a top priority for all of us at Xiaomi. Also, we will attend Mobile World Congress Barcelona 2020 as planned, and launch our latest smartphones as well as a range of smart hardware," the company said. The company also detailed list of precautions it will take to ensure the safety of its employees and the visitors to its booth. "We will make sure that all employees travelling from China show no symptoms and will have been out of China for at least 14 calendar days before their arrival in Barcelona for our launch event and MWC. We will make sure all senior executives of the company scheduled to take part in any kind of activities and meetings will have been out of China for at least 14 calendar days prior to our launch event and MWC," the company added. Recently, Facebook along with Cisco have joined the growing list of companies — including LG electronics, Ericsson, Nvidia, Sony, Amazon, now Intel, Vivo, and NTT Docomo deciding not to attend the mobile trade show citing concerns related to the 2019-nCoV.

US dollar retreats amid stronger risk appetite

New York, The US dollar retreated in late trading on Tuesday as investors' risk appetite went stronger. Market confidence restored on hopes that the outbreak of novel coronavirus infection may close to its peak. Traditional safe-haven currency Japanese Yen weakened against the greenback. In late New York trading, the euro was up to \$1.0920 from \$1.0914 in the previous session, and the British pound increased to \$1.2961 from \$1.2915 in the previous session. The Australian dollar increased to \$0.6713 from \$0.6679, Xinhua reported. The US dollar bought 109.75 Japanese yen, higher than 109.69 Japanese yen of the previous session. The US dollar was down to 0.9754 Swiss franc from 0.9769 Swiss franc, and it fell to 1.3290 Canadian dollars from 1.3318 Canadian dollars.

CORRIGENDUM

Paramount Cosmetics (India) Ltd.
 (CIN: L24240GJ1985PLC008282)
 Regd Office: A-12211, III PHASE, IDC, VAP-36195 (Gujarat)
 Kindly rectify adv. Published on 29/01/2020 for Un-audited Financial Results for the Quarter & Half Year ended 30th Sept. 2019, read as mentioned here:
 (1) 5th Column of advertisement read as 30 Sept-2018 (2) 30th June 19 Quarter: Figure of cost of material consumed is 130.91 instead of 130.91. (3) 30th Sept. 19 Half Year: Other income is 2.71 instead of 2.74

WESTERN RAILWAY-BHAVNAGAR DIVISION

ELECTRICAL WORK
No. DR/M/ET/BVP/2019-20/35 Date: 10.02.2020. The Divisional Railway Manager (Elect.), Western Railway, Bhavnagar Para invites E-tender on behalf of President of India for the following work: **Tender No. 21-2019-20 R:** Name of Work: Bhavnagar Division: Electrical work related to Interlocking of LC gates (2 nos.) - LC no. 14 and 20 between Bhaktinagar and Rbida. **Contract value :** ₹ 396286/- **Tender fee: ₹ 1000/- EMD Amount: ₹ 7900/-** Address: DRM (EL), BVP, DRM Office, Bhavnagar Para-384003. The bidders have to apply online through link i.e. www.iemps.gov.in only. For further details please visit website www.iemps.gov.in. Last date to apply online will be 13.03.2020 up to 15.00 hrs. For above mentioned tenders. **170**
 Like us on: [f facebook.com/WesternRly](https://www.facebook.com/WesternRly)

WESTERN RAILWAY-BHAVNAGAR DIVISION

FLASH BUTT WELDING & HIRING OF VEHICLE
No. W/118/NIT/E-Tender/2019-20/WA/27 date: 10.02.2020 Sub: E-TENDER No. 90/2019-20 to 91/2019-20. Divisional Railway, Manager (works), Western Railway Bhavnagar para invites e-tenders on behalf of President of India for the following works: **Sr.No. 1, E-TENDER No. 90/2019-20, Name of work:** Flash butt welding 52 Kg. Rails between Rajkot - Somnath Section (against the work of Bhavnagar Division: Replacement of existing weld joints between Rajkot-Somnath section). **Tender Value (₹):** 1,90,10,860.90, EMD: 2,45,100.00, **Date of Bidding Start Date:** 27.02.2020, **Date of Bidding Closing:** 12.03.2020, **Sr.No. 2, E-TENDER No. 91/2019-20, Name of work:** ADEN- Botad Sub division: Hiring of utility of vehicle for SSE (W) Botad and SSE(W) Dholka office at (Nos. 2 for 12 months). **Tender Value :** ₹ 11,62,380.48, EMD: ₹ 23,300.00, **Date of Bidding Start Date:** 27.02.2020, **Date of Bidding Closing:** 12.03.2020. The NIT has been uploaded on Railway Website: www.iemps.gov.in on 10.02.2020. **171**
 Like us on: [f facebook.com/WesternRly](https://www.facebook.com/WesternRly)

WESTERN RAILWAY-AHMEDABAD DIVISION

DESIGN, SUPPLY, INSTALLATION, PROGRAMMING, TESTING AND COMMISSIONING OF ELECTRONIC INTERLOCKING (E.I.) SYSTEM
Notice Inviting Tender No. DRM-SnT-ADI-Sig 23 of 2019-20, DRM/S and T acting for and behalf of the President of India invites E-Tenders against Tender No. DRM-SnT-ADI-Sig 23 of 2019-20 closing date 09.03.2020, 15:00 Bidders will be able to submit their original/revised bids upto closing date and time only. Manual offers are not allowed against this tender, and any such manual offer received shall be ignored. Name of Work: Design, Supply, Installation, Programming, Testing and Commissioning of Electronic Interlocking (E.I.) system at Anjar & Ratnal station in Gandhidham - New Bhuj section of Ahmedabad Division along with outdoor S&T work in connection with replacement of mechanical operation. **Level:** Former S.M.'s slide by Electrical operation. **Estimated Cost of work :** ₹ 4,18,39,593.00/- (₹ Four Crore Eighteen Lakh Thirty Nine Thousand Five Hundred Ninety Three only). **EMD: ₹ 3,59,200.00/-** (₹ Three Lakh Fifty Nine Thousand Two Hundred only). **Date and time of Closing:** Not later than 15:00 hrs. of 09.03.2020. **Date and time of opening of Tender:** Opening on 09.03.2020 at 15:30 hrs. **Website of E-Tendering:** www.iemps.gov.in **378**
 Like us on: [f facebook.com/WesternRly](https://www.facebook.com/WesternRly)

WESTERN RAILWAY

CONSTRUCTION OF STATION BUILDING & VARIOUS OTHER WORKS
 Dy. Chief Engineer (Construction) II, Western Railway, Pratapnagar, Vadodara - 390 004 invites Tender as per the details given as follows: **Tender No. D.Y.C/E/III/RC/MY/G-DB-SMLA/23.** Name of Work : Construction of Station Building, Platform, Platform Wall, Water Tank Slabbing, Approach Road - Fencing, Water Supply Arrangements, RCC Overhead Tank, Pump House, Toilet Blocks, Water Huts etc. with Other Ancillary Building Works at Miyagam (B Class), Kayavarohan (B-Class) & Nada (D-Class) and between MYG-Dabhol Section in Connection with Miyagam - Dabhol - Samalaya Gauge Conversion Project. **Approximate Cost of Work:** ₹ 2,08,152 Lakhs. **Availability of Online Tender for Bidding:** From 12/02/2020 at 10:00 hrs. to 03/03/2020 up to 15:00 hrs. **Date of Opening of Tender:** 03/03/2020 at 15:30 hrs. Regarding detailed notice containing cost of tender document (non-refundable), EMD, eligibility criteria, Similar Nature of Work, detailed tender conditions, please visit www.iemps.gov.in Manual offers will not be considered.
 Follow us on: [t twitter.com/WesternRly](https://twitter.com/WesternRly)

Business Brief

SpaceX hires ex-NASA expert, prepares to launch astronauts
San Francisco, Ahead of its launch of astronauts to the International Space Station (ISS) aboard its Crew Dragon capsule which is tentatively scheduled for May 7, the Elon Musk-led SpaceX has hired a top former human spaceflight expert, the media reported.
 In his new role, William Gerstenmaier, the former leader of NASA's human spaceflight programme, is reporting to SpaceX Vice President of mission assurance Hans Koenigsmann, CNBC reported on Tuesday.
 SpaceX is preparing its Crew Dragon spacecraft to fly NASA astronauts Doug Hurley and Bob Behnken to and from the space station in the first flight.
 Showing off its spacecraft on Tuesday, SpaceX said that the Crew Dragon was undergoing electromagnetic interference testing in preparation of its Demo-2 mission, which will be the first to transport astronauts.
 The uncrewed Demo-1 mission flew in March of last year.
 "I'm glad to see a Crew Dragon DM2 capsule video out there to share and show off! Can't wait for the ones from @NASAKennedy as @NASA and @SpaceX bring human spaceflight back to the Florida coast! #LaunchAmerica," Behnken said in a tweet.
 According to a report in Ars Technica, NASA is working toward a May 7 launch of a Crew Dragon spacecraft. But the date is far from finalised.

Flipboard's new video news service launches for \$2.99

San Francisco, News aggregator Flipboard has announced the launch of its new video platform Flipboard TV and it will be exclusively available for Samsung Galaxy S20 owners, who will also get a three-month free trial.
 Called Flipboard TV, the service will sit inside the Flipboard app and contain professional short-form video from more than 100 publishers at launch. The ad-free service will cost \$2.99 per month, CNET reported on Tuesday.
 This marks a new territory for Flipboard, which debuted along with the original iPad in 2010.
 But it's jumping into a scrappy fight, as a wave of new subscription video services grapple to win a share of your streaming budget.
 In addition to established names like Netflix, Amazon and Hulu, new services like Apple TV Plus and Disney Plus are all vying for users' attention and dollars, the report added.
 The new service will feature videos from over 100 sources at launch, including names such as Bloomberg, Variety, The Wall Street Journal and Rolling Stone.
 Apart from News, Business, Politics, Entertainment, Tech, and Local channels, Flipboard TV viewers will also be able to access specialised channels curated by the company's editorial team and its publishing partners.

Sennheiser launches new headphones at Rs 29,990

New Delhi, German audio brand Sennheiser on Wednesday launched its new headphones 'PXC 550-II' for Rs 29,990 in India.
 "PXC 550-II is built to offer the best in class audio for both music and calls. This headset has been created to provide unrivalled experience of sound quality and wireless freedom to its consumers on the go," Kapil Gulati, Director, Consumer Segment, Sennheiser Electronics India, said in a statement.
 "The PXC 550-II is the right blend of superior comfort, style, elegance and sound output. This extraordinary headset is going to revolutionise the way we experience sound as well as ambient noise and will be taking the audio experience to the next level," he added.
 According to the company, the new headphone is upgraded with Bluetooth 5.0 compatibility and support for the high-quality AAC codec. Alongside aptX-M support, these enhancements help to deliver uncompromised sound quality.
 It features a Voice Assistant button that offers convenient, one-touch access to voice assistants such as Siri, Google Assistant as well as Amazon Alexa, and also features a triple microphone array that makes it easy to stay connected while on the move.
 It comes with up to 20 hours of battery life with headphones connected via Bluetooth and ANC (active noise control) switched on.
 —IANS

Nutanix sets up new India headquarters in Bengaluru

Bengaluru, The US-based global enterprise cloud computing company Nutanix on Wednesday said it has officially commissioned its new India headquarters here.
 Nutanix said it has set up the facility to attract more engineering and support staff, and further showcase the company's expansive portfolio of enterprise solutions — to grow its regional client base.
 The facility brings together the sales, engineering, R&D, service and support functions under one roof, and boasts a modern, open plan and engaging workplace, with multiple collaborative and creative spaces as well as an in-house gym, sleep pods, and gaming zones.
 The new campus also has a fully catered canteen facility providing a full breakfast, lunch and dinner menu service for staff, Nutanix said.
 The new 2,000 square feet Bengaluru HQ is situated in the midst of the city's IT hub.
 "We're excited by our new home and the opportunities it provides us. India is integral to delivering the best solutions and service to our global customers and this facility marks yet another step in our ongoing commitment to the country," Sankalp Saxena, Senior Vice President and Managing Director, India Operations, Nutanix said in a statement.
 This move enables Nutanix to expand its innovation ecosystem and grow its investment in talent within the country and continue to nurture a strong internship and incubation programme with the support of local colleges.

SAWACA BUSINESS MACHINES LIMITED

CIN No. L65910GJ1994PLC023926
 Registered Office: 45, Chinubhai tower, Opp. Handloom House, Ashram Road, Ahmedabad - 380009
 Telephone no: 079 26583309 e-mail : sawaca.business@yahoo.com Website: sawacabusiness.com

EXTRACT OF STANDALONE UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER / NINE MONTHS ENDED 31 DECEMBER, 2019 (Rs. In Lakhs)

NO.	PARTICULARS	For the Quarter	For the Quarter	For the Quarter	For the Month	For the Month	For the
		Ended 31/12/2019	Ended 30/09/2019	Ended 31/12/2018	Ended 31/12/2019	Ended 31/12/2018	Year Ended 31/03/2019
1	Total income from operations (net)	46.85	25.85	52.29	152.79	216.71	246.17
2	Net Profit / (Loss) for the period (before tax, exceptional and/or extraordinary items)	15.50	18.93	17.72	14.73	29.38	27.26
3	Net Profit / (Loss) for the period before tax (after exceptional and/or extraordinary items)	15.50	18.93	17.72	14.73	29.38	27.26
4	Net Profit / (Loss) for the period after tax (after exceptional and/or extraordinary items)	15.50	18.93	17.72	14.73	29.38	19.97
5	Total comprehensive income for the period [comprising profit/(loss) for the period (after tax) and other Comprehensive income (after Tax)]	15.50	18.93	17.72	14.73	29.38	19.97
6	Paid up Equity Share Capital (Equity shares of Rs.10/-each fully paid)	1,040.09	1,040.09	1,040.09	1,040.09	1,040.09	1,040.09
7	Earnings Per Share (of Rs.10/- each)						
Basic :		0.15	0.18	0.17	0.14	0.28	0.19
Diluted:		0.15	0.18	0.17	0.14	0.28	0.19

Notes:
 1 The above standalone financial results were reviewed by the Audit Committee and taken on record by the Board of Directors at their meeting held on February, 11, 2020.
 2 Previous period figures have been regrouped and rearranged, whenever considered necessary.
 3 The above is an extract of the detailed format of Quarterly Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (LODR) Regulations, 2015. The full format of the Quarterly Financial Results are available on the Stock Exchange website www.bseindia.com and on the Company's website www.sawacabusiness.com.
 Date: 11/02/2020
 Place : Ahmedabad
 By order of the Board
Sawaca Business Machines Limited
Shetal Shah
 DIN: 02148909
 Managing Director

MINAXI TEXTILES LIMITED

CIN : L 17119GJ1995PLC025007
 Regd.Office: Plot No. 3311, G.I.D.C. Phase IV, Chhatral, Tal. Kalol Chhatral, Gandhinagar 382729

EXTRACT OF STANDALONE UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED ON 31.12.2019

Sr. No.	Particulars	For the Quarter	For the Quarter	For the Quarter	Nine	Nine Months	Year ended
		ended 31/12/2019	ended 30/09/2019	ended 31/12/2018	Months ended 31/12/2019	ended 31/12/2018	ended 31/03/2019
1	Total Income from Operations	77.28	168.70	940.48	1124.86	3393.28	4447.32
2	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items#)	-64.6	62.71	9.94	-176.82	28.12	15.98
3	Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items#)	-64.6	62.71	9.94	-176.82	28.12	15.98
4	Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items#)	-51.05	-39.76	6.72	-127.39	17.81	16.13
5	Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	-50.35	-39.52	7.4	-125.31	19.84	20.68
6	Equity Share Capital	494.16	494.16	494.16	494.16	494.16	494.16
7	Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of the previous year						
8	Earnings Per Share (of Rs. 1/- each) (for continuing and discontinued operations) -						
1. Basic:		-0.10	-0.08	0.01	-0.26	0.04	0.03
2. Diluted:		-0.10	-0.08	0.01	-0.26	0.04	0.03

NOTES:
 1 The above is an extract of the detailed format of Quarterly and Nine Months on 31st December 2019, Unaudited Financial Results filed with the Stock Exchange under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly and Nine Months ended 31st December 2019 Unaudited Financial Results are available on the website of the Stock Exchange : www.bseindia.com and the company's website :